

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination
February/March. -2020

COMPUTERIZED ACCOUNTING SYSTEM USING TALLY - 1(DISC. SPE. ELE -2)

Time: 2:00 Hours

Marks: 50

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઈપણ બે) (૧૩)
- A. એકાઉન્ટિંગનો ખ્યાલ, સિધ્ધાંતો અને પ્રણાલીઓ પર ટૂંકનોંધ લખો.
 - B. TALLY-9 ERP ની ખાસિયતો સમજાવો.
 - C. એકાઉન્ટિંગના ગોલ્ડન નિયમો સમજાવો.
 - D. એકાઉન્ટ્સના પ્રકારો પર નોંધ લખો.
- પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઈપણ બે) (૧૩)
- A. એકાઉન્ટ્સના ચાર્ટસ સમજાવો.
 - B. ઇન્વેન્ટરી માસ્ટર્સ બનાવવા પર નોંધ લખો.
 - C. ગ્રુપ્સ અને લેજર્સ પર નોંધ લખો છે.
 - D. સ્ટોક ગ્રુપ અને સ્ટોક કેટેગરી સમજાવો.
- પ્રશ્ન.૩ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઈપણ બે) (૧૨)
- A. એકાઉન્ટિંગ વાઉચર રેકોર્ડિંગ કરવા માટેના સ્ટેપ્સ સમજાવો.
 - B. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવા પર નોંધ લખો.
 - C. ઇન્વેન્ટરી વાઉચર રેકોર્ડિંગ કરવા માટેના સ્ટેપ્સ સમજાવો.
 - D. ઇન્વેન્ટરી બુક્સ અને રિપોર્ટ્સ વિશે નોંધ લખો છે.
- પ્રશ્ન.૪ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઈપણ બે) (૧૨)
- A. બેકઅપ અને રિસ્ટોર સમજાવો.
 - B. ડેટાનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સમજાવો.
 - C. ટેલીમાં સિક્યુરીટી કંટ્રોલ સમજાવો.
 - D. ટેલીમાં રિપોર્ટ્સનું પ્રિન્ટિંગ સમજાવો.

ENGLISH VERSION

- Q.1 Answer of following questions (any two) (13)
- A. Write short note on accounting principles, concept and conventions.
 - B. Explain features of tally 9 ERP.
 - C. Explain golden rules of accountings.
 - D. Write note on types of accounts.
- Q.2 Answer of following questions (any two) (13)
- A. Explain charts of accounts.
 - B. Write note on creating inventory masters.
 - C. Write notes on groups and ledgers.
 - D. Explain stock group and stock categories.
- Q.3 Answer of following questions (any two) (12)
- A. Explain steps of recording accounting vouchers.
 - B. Writes notes on generating financial statements.
 - C. Explain steps for recording inventory vouchers.
 - D. Writes notes about inventory books and reports.
- Q.4 Answer of following questions (any two) (12)
- A. Explain backup and restore.
 - B. Explain export and import of data.
 - C. Explain security controls in tally.
 - D. Explain printing of reports in tally.
